



CORAL LABORATORIES LTD

AN ISO 9001: 2008 CERTIFIED ORGANIZATION



REGD. OFFICE : SF-206, Silver Oak Complex, B.P.C. Road, Vadodara - 390 020.
CORP. OFFICE : #3B, Patanwala Compound, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (West), Mumbai - 400 086. India.
Tel. : +91-22-2500 5245, 2500 8208, 2500 5246. • Fax : +91-22-2500 4893. • E-mail : accounts@corallab.com • Website : www.corallab.com
CIN NO. L24231GJ1997PL C031669

24th May 2023

To,
The Manager
Corporate Relations Department,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai- 400 001.

REF : SCRIP CODE NO.524506

Dear Sir/Madam,

Subject: Compliance under Regulation 47 of the SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations 2015

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of extract of Audited Standalone Financial Results of the Company for the quarter and year ended March 31, 2023, published in following newspapers dated 24.05.2023: -

1. Business Standard (English)
2. Western Times (Gujarati)
3. Western Times (English)

Kindly take the same on your record.


Thanking you and assuring you of our best co-operation at all times.

Yours sincerely,

For CORAL LABORATORIES LIMITED

Ruchi Anjaria
Company Secretary & Compliance Officer
M No. A54803

Encl.: as above

BARODA GUJARAT GRAMIN BANK  **વડોદરા ગ્રામીણ ગ્રામીણ બેંક**
Regional Office, Surat

Whereas, the undersigned being the authorised officer of the BARODA GUJARAT GRAMIN BANK under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance Act, 2002 (Ord. 3 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the borrower, to repay the amount mentioned in the notice and interest thereon within 60 days from the date of receipt of the said notice. The borrowers/mortgagors having failed to repay the amount, notice is hereby given to the borrowers/mortgagors and the public in general that the undersigned has taken the Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Ordinance Act read with rule 9 of the said rules.

The borrowers/mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Baroda Gujarat Gramin Bank - Bharuch Branch for an amount and interest thereon till date of payment thereof.

Name of the borrowers/mortgagors	Demand Notice Date	Possession Notice Date	Outstanding amount + Interest and charges thereon
Mr. Mangalbhai Khamanbhai Chauhan & Mrs. Radhaben Mangalbhai Chauhan	08-02-2023	19-05-2023	Rs.19,85,496.78 (Rupees Nineteen Lacs Eighty Five Thousand Four Hundred Ninety Six and paise Seventy Eight Only)

Description of the immovable property: All the pieces & parcels of property, The Property bearing Revenue Survey No. 96 admeasuring area 32/27 sq. mtrs. police Building A, police flat on third floor, Flat No. A-306, admeasuring square built up area 34.30 sq. mtrs and undivided share of land 28.29 sq. mtrs. of Crystal Avenue within village limit of Village : GADKHO, Ta. Ankleshwar, Dist. Bharuch, in the name of Mr. Mangalbhai Khamanbhai Chauhan & Mrs. Radhaben Mangalbhai Chauhan, bounded as under: East- AdJ. building open space, West- AdJ. Flat No. A-305, North- AdJ. Building after open space, South- AdJ. passage

Mr. Hitesh Rambhaji Parmar **08.06.2022** **19.05.2023** **Rs.23,38,885.68 (Rupees Twenty Three lakhs Thirty Eight thousand Eight hundred Eighty Five and Paise Sixty Nine Only)**

Description of the immovable property: The Property bearing Revenue Survey No. 98 police flat No. B-404, 4th Floor, B-Building, in Crystal Avenue Admeasuring Area 34.30 Sq. Mt. undivided share of land 28.29 Sq. Mt. situated in s.m of Gadkoi, Ta-Ankleshwar, Dist Bharuch, in the name of Mr. Hitesh Rambhaji Parmar, bounded as under: East- AdJ. building open space, West- AdJ. Flat No. B-403, North- AdJ. Building after open space, South- AdJ. passage

The borrower's attention is invited to sub section (8) of section 13 in respect of time available to redeem the secured assets.

Date: 19-05-2023 Place: Bharuch Chief Manager & Authorised Officer, Baroda Gujarat Gramin Bank

RECTIFICATION IN PUBLIC NOTICE

I have published Public Notice in daily newspaper "Business Standard" on 20.04.2023 for the property bearing Flat No. 204 of "Chitrakoot Apartment", bearing R.S. No. 150/B, T.P. Scheme No. 4 (Umra-South), F.P. No. 91 of Village: Umra, Taluka: Majura, (Surat City), District: Surat and (1) The Original Sale Deed vide Registration No. 8768 Dated: 4.08.2005 & (2) The Original registration fee receipt Dated: 22.07.2005 are misplaced/not available. (Date: 24.05.2023)

JIGISHA K. SHAH (ADVOCATE)
MOBILE NO : 98252 94942

दि मध्यप्रदेश स्टेट माइनिंग कारपोरेशन लि.
(मध्यप्रदेश शासन का उपकरण)

पंजीकृत कार्यालय : पर्यावरण भवन, ब्लॉक नं. 1 (ए), द्वितीय तल, जेल रोड, अंशु हिन्दू, भोपाल-462011, दूरभाष : 2763391, 2763392
फैक्स : 0755-2763394, E-mail info.mpsnc@mp.gov.in
Website : www.mpsncmp.gov.in
CIN : U0140MP1962SGC000937
दि. : 23.05.2023

सिलिका सैंड खनिज के उत्खनन एवं विक्रय हेतु एम.डी.ओ. के चयन बाबत ई-निविदा सूचना

दि म.प्र. स्टेट माइनिंग कारपोरेशन लि. की जिला रीवा के ग्राम रसुनाधपुर में 14,000 हे. रकबा में स्थित सिलिका सैंड खदान से सिलिका सैंड खनन एवं विक्रय हेतु एम.डी.ओ. के चयन बाबत ई-निविदा सूचना ऑनलाइन पोर्टल <https://mptenders.gov.in> के माध्यम से इच्छुक एवं पात्रता रखने वाले निविदाकारों से निमन ऑनलाइन निविदाएं आमंत्रित करता है। विस्तृत विवरण <https://mptenders.gov.in> पोर्टल पर तथा निमन की वेबसाइट www.mpsncmp.gov.in पर दिनांक 24.05.2023 से उपलब्ध होगा।

म.प्र. माध्यम/110005/2023 प्रबंध संचालक

CFM ASSET RECONSTRUCTION PRIVATE LIMITED (CFM-AR)
CFM ASSET RECONSTRUCTION PRIVATE LIMITED
REGISTERED OFFICE: Block No.1/1003, West Gate, Near YMCA Club, Sur. No.835/1+3, S.G.Highway, Makbara, AHMEDABAD-380 051 - GUJARAT

CORPORATE OFFICE: 1st Floor, valkahi House, Spurt road, Ballard Estate, MUMBAI - 400 038. EMAIL : rajani@cfmarc.in, CONTACT:079-65118554/079-65118555; +91 98223 57619.

APPENDIX - A/B SALE NOTICE (Proviso to rule 8(i))
FOR SALE OF IMMOVABLE PROPERTIES

Auction Sale Notice for sale of immovable assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to rule 8(i) of the Security Interest Enforcement Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower and Guarantors/Mortgagors that the below described immovable property(ies) mortgaged/charged to the Secured Creditor, the Physical Possession of which has been taken by the Authorised Officer of CFM Asset Reconstruction Pvt. Ltd. on 11.03.2023, will be sold on "As is where is", "As is what is", "Whatever there is" and "No reserve Basis" on 05.07.2023 for recovery of dues Amounting to **Rs.35,21,752.75 (Rupees Thirty Five Lac Twenty One Thousand Seven Hundred Fifty Two and paise Seventy Five Only)** as on 01.04.2019 and further interest and other costs and expenses thereon due to the secured creditor from **Borrower/Mortgagor - 1. A.Mart Junior, (Borrower) 2. Mrs. Hansabai Khilolani (Co-borrower & Mortgagor) 3. Mr. Dipak Sureshbhai Khilolani (Co-borrower & Mortgagor).**

DETAILS OF PUBLIC AUCTION

DESCRIPTION OF PROPERTY

- All the piece and parcel of Commercial Property: Shop No.125, owned by Mr. Hansabai S. Khilolani admeasuring 25.43 Sq. Mt. and undivided land area of 7.54sq.mtrs on first floor of Jula Arcade Registration Dist : Anand, Sub Dist : Vallabh vidhyanager, CS No.234, which is bounded as follows : Towards East : 1st Floor Shop No.123, Towards West : After leaving OTS Margin, road, Towards North : 1st Floor Shop No.125, Towards South : After leaving OTS Margin, Vidhyanager Dary.
- All the piece and parcel of Commercial Property - Shop No.125, owned by Mr. Deepak S. Khilolani admeasuring 25.43 Sq. Mt. and undivided land area of 7.54 sq.mtrs on first floor of Jula Arcade in Registration Dist : Anand, Sub Dist : Vallabh vidhyanager, CS No.234, which is bounded as follows : Towards East : 1st Floor Shop No.123, Towards West : After leaving OTS Margin, road, Towards North : 1st Floor Shop No.125, Towards South : 1st Floor Shop No.124.

SECURED DEBT

RESERVE PRICE (R.P.) 11.00 am to 12.00 pm, 05.07.2023

DATE, TIME AND PLACE OF PUBLICATION 11.00 am to 12.00 pm, 05.07.2023

CFM Asset Reconstruction Private Limited, Block No.1003, West Gate, Near YMCA Club, Sur. No.835/1+3, S.G. Highway, Makbara, AHMEDABAD-380 051 GUJARAT.

DETAILS OF TERMS AND CONDITIONS Please visit www.cfmarc.in

DATE OF INSPECTION With Prior appointment of Authorised Officer

LAST DATE FOR SUBMISSION OF BID DOCUMENT 30.06.2023 till 11.00 AM

EMD **Rs. 5,47,400/- (Rupees Five Lac Forty Seven Thousand Four Hundred Only)**

Encumbrances if any: Not known to the secured creditor.

For details of Terms and Conditions of Sale please refer to the link provided in Sale Notice on secured Creditor's website i.e. <http://www.cfmarc.in> Sd/-
Date : 24.05.2023 Authorised Officer, CFM Asset Reconstruction Pvt. Ltd. Place : Ahmedabad (Acting as trustee of CFMARC Trust - 4 IJNDIN)

CORAL LABORATORIES LIMITED
Registered Office: SF-206, Silver Oak Complex, BPC Road, Vadodra, Gujarat - 390020
Corp Office: 3/B Patanwala Compound, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai, Maharashtra - 400 086, Tel: 022-2500 5245
Email: cs@corallab.com Website: www.corallab.com
CIN: L24231GJ1997PLC031669

Statement of Standalone Audited Financial Results for the Quarter and Year ended March 31, 2023
₹ in Lacs (Except figures of EPS)

Sr No	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)
1	Total income from operations (net)	1,259.91	2,622.71	2160.55	8501.35
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items*)	-162.15	173.94	202.70	818.80
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items*)	-162.15	177.75	298.64	822.61
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items*)	-89.22	85.75	254.64	644.54
5	Total Comprehensive income for the period (Comprising Profit/Loss for the period (after tax) and Other comprehensive income (after tax))	-557.16	-53.80	125.39	-125.50
6	Equity Share Capital	357.26	357.26	357.26	357.26
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			15122.55	15248.05
8	Net Worth			15479.81	15605.31
9	Earnings Per Share (before extraordinary items) (of Rs. 10/- each)				
Basic		-2.50	2.40	7.13	18.04
Diluted		-2.50	2.40	7.13	18.04
10	Earnings Per Share (after extraordinary items) (of Rs. 10/- each)				
Basic		-2.50	2.40	7.13	18.04
Diluted		-2.50	2.40	7.13	18.04

Note:

- Above Audited Financial Results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 23, 2023.
- The above is an extract of the detailed format of Standalone Audited Financial Results for the quarter and year ended March 31, 2023 filed with Stock Exchange on 23rd May, 2023 under Reg 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Audited Financial Results are available on Stock Exchange website (www.bseindia.com) and the company website (www.corallab.com)
- The Company has adopted Ind AS for the financial year commencing from 1st April, 2017 and above results have been prepared in accordance with Ind AS, as prepared under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies Accounting Standards) Rule, 2015.

For and on behalf of the Board of Director of
Coral Laboratories Limited
Sd/-
Sushma Kadkade
Director & CFO
(DIN : 07791375)

Place : Mumbai
Date : 23rd May, 2023



How to Meet Decision Makers
without an Appointment

Grow your business with Business Standard – the smart choice to reach those who matter!

- 71% readers in NCCS A1 and A2
- 12 English, 6 Hindi editions: 1000+ towns
- 6 lakh registered users, 12 million unique visitors per month
- Print readers spend >15 min per day, digital >5 min per visit
- The most-read business medium in top B-Schools
- 150+ events every year

Write to sales@bsmail.in now, for a customised solution to your business requirements

Business Standard
Insight Out

 bsindia  bsindia business-standard.com

Shankara Building Products Ltd.
CIN: L26922KA1995PLC018990
Registered Office: G2, Farah Winford, 133 Infantry Road, Bengaluru-560001
Corporate Office: No. 21/1 & 35-A-1, Hosur Main Road, Electronic City Post, Veerasandra, Bengaluru-560100
Phone: +91 80-40117777, +91 80-27369555; Fax: +91 80-41119317
Website: www.shankarabuildpro.com
Email: compliance@shankarabuildpro.com

NOTICE OF THE 28TH ANNUAL GENERAL MEETING OF THE MEMBERS OF SHANKARA BUILDING PRODUCTS LIMITED "THE COMPANY"

Notice is hereby given that the Twenty Eighth ("28TH") Annual General Meeting ("AGM") of the Members of the Company will be held on Thursday, 22nd June, 2023 at 10.30 a.m. (IST), through Video Conference ("VC") or other audio-visual means ("OAVM") in compliance with General Circular Nos. 20/2020 and 10/2022 dated 5th May 2020 and 28th December 2022, respectively, and other circulars issued in this respect. ("MCA Circulars") issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular No. SEBI/HO/CFD/POD-2/P/CIR/2023/4 dated 5th January 2023 ("SEBI Circular") issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "Circulars") to transact the business as set out in the Notice convening the 28th AGM.

The Notice of the AGM along with the Annual Report for the financial year 2022-23 will be sent in due course only by electronic mode to all the shareholders whose email addresses are registered with the Company/Registrar and Share Transfer agent (RTA)/Depository Participant(s) in accordance with the aforesaid Circulars. The Notice of the AGM and the Annual Report will be made available on the Company's website at <https://www.shankarabuildpro.com> and on the websites of the Stock Exchanges where the shares of the Company are listed i.e. BSE Limited (www.bseindia.com) and the National Stock Exchange of India Limited (www.nseindia.com) respectively. The members can participate in the AGM through VC/OAVM and the procedure of participating in the AGM will be provided in the Notice of the 28th AGM.

The Company is providing remote e-voting facility as well as e-voting facility during the 28th AGM. Members are requested to register their email addresses to receive the Notice and the Annual Report and User ID/password for e-voting/ remote e-voting with Kfintech Technologies Limited (the Company's RTA) on the following link <https://ris.kfintech.com/client-services/mobilemailreg/mobilemailreg.aspx> in the manner stated below in the Notice.

Members (holding shares in both Physical/Electronic mode) are encouraged to register their email addresses to enable them to cast their vote through the remote e-voting system prior to the AGM (which shall commence on Monday, June 19, 2023 from 9:00 A.M. (IST) to Wednesday, June 21, 2023 till 05:00 P.M. (IST), inclusive of both days or through e-voting during the 28th AGM and the detailed procedure for remote e-voting and e-voting shall be given in the Notice. Further the Register of Members shall be closed from Thursday, 15th June, 2023 to Thursday, 22nd June, 2023 (inclusive of both days) for the purpose of the AGM.

Process for registration of email address for obtaining Notice and Annual Report (if not received by the Members) and/or obtaining User ID/password for e-voting are stated as here under:

Physical Holding
Submit a request to Kfintech at <https://ris.kfintech.com/client-services/mobilemailreg/mobilemailreg.aspx> providing Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR Card (self-attested scanned copy of Aadhaar Card) for registering email address on or before Wednesday, June 14, 2023.

Demat Holding
Please contact your Depository Participant (DP) and register your email address and bank account details in your demat account, as per the process advised by your DP.

The above information is being issued for the information and benefit of all the Members of the Company and in compliance with the Circulars. For any queries/clarification/grievance/s members may contact the undersigned at compliance@shankarabuildpro.com

For Shankara Building Products Limited
Sd/-
Reena Vikram
Company Secretary & Compliance Officer

Place: Bengaluru
Date: May 23, 2023

nuvama
NUVAMA WEALTH FINANCE LIMITED
(Formerly known as Edelweiss Finance & Investments Limited)

Corporate Identity Number: U67200MH994PLC286057
Registered Office: 801- 804, Wing A, Building No. 3, Inspire BKC, G Block, Bandra Kurla Complex, Bandra East, Mumbai - 400 051 • Tel No : +91 22 6620 3030 • Website: nuvamafinance.com

Financial Results for the quarter and year ended March 31, 2023 (₹ in Millions, except per share data)

	Quarter ended		Year ended	
	March 31, 2023 (Audited)	March 31, 2022 (Unaudited)	March 31, 2022 (Unaudited)	March 31, 2023 (Audited)
1 Total income from operations	1171.65	1,341.55	1,060.01	4,539.79
2 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	349.75	364.30	132.70	973.56
3 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	349.75	364.30	132.70	973.56
4 Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	263.31	274.45	102.28	717.55
5 Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	258.46	274.45	97.01	712.70
6 Paid-up equity share capital (Face Value of ₹ 10/- Per Share)	114.59	114.59	114.59	114.59
7 Reserves (excluding Revaluation Reserves)	7,565.65	7,305.95	6,849.44	7,565.65
8 Securities premium account	5,086.37	5,086.37	5,086.37	5,086.37
9 Net worth	7,680.24	7,420.54	6,964.03	7,680.24
10 Paid-up Debt Capital / Outstanding Debt	27,465.25	26,995.35	24,174.94	27,465.25
11 Outstanding Redeemable Preference Share Capital (Face Value of ₹ 10/- Per Share)	151.75	148.43	153.40	151.75
12 Debt Equity Ratio ^(*)	3.58	3.64	3.47	3.58
13 Earnings Per Share (₹) (Face Value of ₹ 10/- each)				
- Basic (Refer note 6)	22.98	23.95	8.93	62.62
- Diluted (Refer note 6)	22.98	23.95	8.93	62.62
14 Capital Redemption Reserve	231.33	231.33	230.33	231.33
15 Debenture Redemption Reserve	NA	NA	NA	NA
16 Debt Service Coverage Ratio (DSCR)	NA	NA	NA	NA
17 Interest Service Coverage Ratio (ISCR)	NA	NA	NA	NA

Net worth = Equity share capital + Other Equity – Deferred Tax Assets
Debt-equity Ratio = Total debt (Debt securities + Borrowings other than debt securities + subordinated liabilities) / Net worth

Notes:

- On September 19, 2022, the company has changed its name from Edelweiss Finance & Investments Limited to Nuvama Wealth Finance Limited.
- The above is an extract of the detailed format of quarterly and year ended March 31, 2023 financial results filed with the Stock Exchanges in accordance with Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended (the "Listing Regulations, 2015") and the Indian Accounting Standards specified under section 133 of the Companies Act, 2013 read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended and the relevant provision of the Companies Act, 2013, as applicable. The full format of the financial results are available on the website of the Stock Exchange (www.bseindia.com) and the Company's website (<https://nuvamafinance.com>).
- For the other line items referred in regulation 52 (4) of the LODR Regulations, pertinent disclosures have been made to the Stock Exchange (BSE) and on the Company's Website and can be accessed on the URL (<https://nuvamafinance.com>).
- The above financial results of the Company have been reviewed and recommended by the Audit Committee and thereafter approved by the Board of Directors at their respective meetings held on May 22, 2023.
- The above financial results for the quarter and year ended March 31, 2023 have been subjected to audit by the Statutory Auditors of the Company and the auditors have issued an unqualified report.
- Earnings per share for the quarters ended March 31, 2023, December 31, 2022, March 31, 2022 are not annualized.

For and on behalf of the Board of Directors
Sd/-
Tushar Agrawal
Executive Director & Chief Executive Officer
DIN: 08295408

Mumbai, May 22, 2023.

TN state transport orders bus conductors not to accept Rs 2,000 notes from passengers

Chennai, May 22 (IANS) The Tamil Nadu State Transport Corporation, Tirunelveli, has issued a circular instructing bus conductors not to accept Rs 2,000 denomination notes from passengers or exchange the same for lower value note.

Oral instructions have been given by other State Transport Undertakings to their bus conductors on similar lines.

Meanwhile, retail outlets and fuel stations have also stopped accepting Rs 2,000

denomination notes.

Meanwhile the State Bank of India (SBI) has issued a circular instructing the branch officials not to ask the public who come for exchange of the Rs 2,000 notes to fill in a challan/slip.

"The RBI has clearly stated that the Rs 2,000 notes will continue to be a legal tender and hence it is not understood as to why all these details are required to be submitted to the bank by the public for exchanging the notes. It is cumbersome for the public as well as for

the bank employees/officers," said C.H. Venkatachalam, General Secretary, All India Bank Employees' Association (AIBE) in a letter to Indian Banks' Association (IBA). Stating that the prescribed procedure is unwarranted, Venkatachalam urged IBA to come out with a uniform procedure for banks to follow while exchanging the Rs 2,000 notes. "The bank management are yet to come out of the Rs 500/Rs 1,000 banknote demonisation syndrome. Demonisation

is different and withdrawal of Rs 2,000 note is different," Venkatachalam told IANS. The slip for exchange and deposit of Rs 2,000 banknotes has its roots in the RBI's May 19 circular to the banks on the withdrawal of the said currency. "Deposit of Rs 2000 banknotes into accounts maintained with all banks can be made in the usual manner, that is, without restrictions and subject to compliance with extant Know Your Customer (KYC) norms and other applicable Statutory require-

ments. The banks shall also be required to comply with Cash Transaction Reporting (CTR) and Suspicious Transaction Reporting (STR) requirements, where applicable," the RBI circular notes. On May 19, the RBI said it will withdraw all the Rs 2,000 banknotes as a part of its clean note policy and added that it will continue to be a legal tender. According to the RBI, people may deposit Rs 2,000 banknotes into their bank accounts and/or exchange them into banknotes of other denomi-

nations at any bank branch. "Deposit into bank accounts can be made in the usual manner, that is, without restrictions and subject to extant instructions and other applicable statutory provisions." The central bank said in order to ensure operational convenience and to avoid disruption of regular activities of bank branches, exchange of Rs 2,000 banknotes into banknotes of other denominations can be made upto a limit of Rs 20,000 at a time at any bank starting from May 23.

UP Power consumer can claim compensation for service faults

Lucknow, May 23 (IANS) Electricity consumers in Uttar Pradesh will now be able to legally claim compensation for a default in the delivery of services by the UP Power Corporation Ltd (UPPCL). The UPPCL has implemented the law made in this regard by the UP Electricity Regulatory Commission (UPERC) more than three years ago. "UPPCL chairman M. Devraj has informed the UPERC that the corporation has implemented the compensation law through an online software in the entire state," a UPERC official said. According to the order issued by Devraj in this regard, consumers can register their complaint about a service default as well

as their compensation claim on the corporation's 1912 toll-free number, in case the complaint is not resolved within the specified timeframe. "The compensation number will be generated online separately to the consumer concerned and the claim too will be processed online. Compensation will be provided to all eligible complainants within a maximum of 60 days from the date of lodging the complaint," the UPPCL chief said in his order. The Standard of Performance Regulations was notified by the UPERC in December 2019, fixing the maximum time for the delivery of services. It also prescribed fines to be imposed on discoms in case of a default. As part of the Regulation, standards of performance will form the basis to

measure performance against the standards for the licensee in providing service and ensuring that distribution companies meet minimum standards which are necessary from the perspective of consumers.

Paytm Money launches bond investing, to drive innovation by simplifying investing

New Delhi, May 23 (IANS) One97 Communications Limited (OCL), that owns leading mobile payments and financial services company Paytm, on Tuesday announced that its wholly-owned subsidiary Paytm Money Limited has launched the most advanced bonds platform for retail investors in the country.

The company said it is simplifying bonds for retail investors and enabling them to invest in three types of bonds — government, corporate and tax-free. "This is just the start of bonds investing in India. We believe bonds are the best way for first-time investors to

enter capital markets and every Indian should have a diversified wealth portfolio with bonds being a core part of it. We will continue to bring the best technology-driven features for investors with the safety and security they deserve," said Varun Sridhar, CEO, Paytm Money. Bonds on Paytm money app presents investors all relevant information at one place, and converts everything to help investors analyse and understand the returns they can earn.

WESTERN RAILWAY - AHMEDABAD

TENDER NOTICE

TELECOMMUNICATION WORK IN CONNECTION WITH GAUGE CONVERSION WORK

(SIGNAL & TELECOMMUNICATION) Tender Notice Dy Chief Signal & Telecom Engineer, Construction, Western Railway, 3rd Floor, "A" Wing, Nirman Bhawan, Near DRM Office, Opposite GCS Hospital, Ahmedabad-382345, acting for and on behalf of the President of India invites e-tender for the following work: (1) **Tender No. DY.CSTE/C/ADI/23-24/77** (2) **Name of Work:** Supply of Material, Installation, trenching, Laying of OFC/Quad, blowing, splicing, jointing, termination, testing and commissioning of Telecommunication work including block section in connection with Gauge conversion work between Bhuj-Naliya section in Ahmedabad Division on Western Railway. (3) **Approximate cost of work:** ₹ 6,45,50,00/- (₹ Six Crore Forty-Five Lakhs Fifty-Five Thousand Sixty-Six only). (4) **Bid security :** ₹ 4,72,800/- (₹ Four Lakhs Seventy-Two Thousand Eight Hundred only). (5) **Time & Date for closure for submission of the e-tender documents:** Submission of e-tender : 26.05.2023 upto 15.00 hrs. and Opening at 26.05.2023 at 15.30 Hrs. (6) **Time and Date for opening:** 15.30 hrs. on 26.05.2023 (7) **Website particular and Notice Board** where details of tender can be seen & address of the office: Website: www.ireps.gov.in Office of the Dy. Chief Signal & Telecom Engineer (Const.), Western Railway, Ahmedabad (Gujarat-382345) (8) **Completion period of work :** Twelve (12) Months from date of issue of letter of Acceptance. No. DY/ISG/W/118/77 Dated 23.05.2023

Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

WESTERN RAILWAY/VADODARA DIVISION

SIGNAL & TELECOMMUNICATION DEPARTMENT "E" TENDER NOTICE

TELECOM WORK

TENDER NOTICE No. S&T/BRC/23-24/06/TELE Dtd. 19.05.2023 Sr. DSTE/ Vadodara acting for and on behalf of The President of India invites E-Tenders against Tender No. SandT... BRC_23-24_06 TELE. Bidders will be able to submit their original / revised bids upto closing date and time only. Manual offers are not allowed against this tender, and any such manual offer received shall be ignored. (1) **Name of the Work with its location :** Supply, Installation, Testing & Commissioning of Telecom Materials in connection with the work "Vadodara Division: Provision of Voice Logging Facility based Master-Slave Communication System at all remaining non-interlocked LC Gates". (2) **Approx. cost of the work :** ₹ 34,36,329/- (Approx.) (3) **Bid Security to be deposit :** ₹ 68,700/- (4) **Date & Time for submission of e-tender and opening of e-tender:** 19.06.2023 at 15.00 Hours and 19.06.2023 at 15.30 Hours. (5) **Website particulars and notice for location where complete details can be seen etc. :** <http://www.ireps.gov.in> Senior Divisional Signal & Telecommunication Engineer, 2nd Floor, Annex Building, DRM's Office, Western Railway, Pratapnagar, Vadodara-390 004.

Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

PUBLIC NOTICE ENVIRONMENTAL CLEARANCE

It is hereby informed that the State-level Environment Impact Assessment Authority, Gandhinagar, Gujarat has accorded the Environment Clearance for Manufacturing of SYNTHETIC ORGANIC CHEMICALS by M/s. Narmada Chemicals Plot No: C-298/2/3, Saykha Industrial Estate, GIDC, Taluka: Vagra, Dist.: Bharuch, Gujarat -vide File no: SEIAA/GUJ/EC/S(f)/304/2023 dated 1ST March 2023. A copy of the clearance letter is placed at the office of the Gujarat Pollution Control Board (Bharuch & Gandhinagar) and may also be seen at the website of State Level Environment Impact Assessment Authority, Gandhinagar, Gujarat at <http://seiaa.gujarat.gov.in/>

AUTHORIZED SIGNATORY
M/s. Narmada Chemicals

Date: 23/05/2023

WESTERN RAILWAY

CORRIGENDUM TO E-AUCTION SALE PROGRAMME

MATERIAL MANAGEMENT DEPARTMENT

Additional E-Auction Sale program during June 2023 for PWay and other various Scrap

E-Auction Sale Notification No. S/ISIII/Auction Programme-1 / JUNE 2023 Dated 11.04.2023. The following additional E-auction program for disposal of PWay Scrap Material will also be held in June 2023 in addition to existing for following division:

Division	Additional E - Auction program of June 2023	Divisional Officer in Charge	Contact No.
Vadodara	01.06.2023	Sr. Divisional Materials Manager-Vadodara	02652641592 09724091750

All other terms and conditions will remain unchanged. Please visit Western Railway Website of material Management Department i.e. www.wr.indianrailways.gov.in as well as on www.ireps.gov.in e-auction portal for further information.

(No. S/ISIII/Auction Programme-3/JUNE 2023 Dt. 22.05.2023) 0222

Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly) | follows us on: twitter.com/WesternRly

PATEL INDUSTRIES
AN ISO 9001 : 2008 COMPANY

CMC-Sodium Carboxymethyl Cellulose For Textiles, Detergents, Paints, Pesticide, Ceramic, Oil well drilling, Welding Electrodes etc.

CMS-Carboxy Methyl Starch For Textiles, Briquettes,

Cellulose Powder For welding rods

Address : Plot No 5623/c, Phase II, GIDC Industrial Area, Vatva, Ahmedabad-382445. Gujarat India.
CONTACT +91 98799 97220.
E-MAIL : info@patelindustries.co.in

Manufacturer & Exporter of Speciality Chemicals

CORAL LABORATORIES LIMITED

Registered Office: SF-206, Silver Oak Complex, BPC Road, Vadodara, Gujarat - 390020
Corp Office: 3/B Patanwala Compound, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai, Maharashtra - 400 086, Tel: 022-2500 5245
Email: cs@corallab.com Website: www.corallab.com
CIN: L24231GJ1997PLC031669

Statement of Standalone Audited Financial Results for the Quarter and Year ended March 31, 2023

₹ in Lacs (Except figures of EPS)

Sr No	Particulars	Quarter Ended			Year Ended	
		31.03.2023 (Audited)	31.12.2022 (Unaudited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2022 (Audited)
1	Total income from operations (net)	1,259.91	2,622.71	2160.55	8501.35	8042.44
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items*)	-162.15	173.94	202.70	818.80	1089.63
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items*)	-162.15	177.75	298.64	822.61	1185.57
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items*)	-89.22	85.75	254.64	644.54	904.57
5	Total Comprehensive income for the period (Comprising Profit/Loss for the period (after tax) and other comprehensive income (after tax)	-557.16	-53.80	125.39	-125.50	1940.98
6	Equity Share Capital	357.26	357.26	357.26	357.26	357.26
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year				15122.55	15248.05
8	Net Worth				15479.81	15605.31
9	Earnings Per Share (before extraordinary items) (of Rs.10/- each)	-2.50	2.40	7.13	18.04	25.32
	Diluted:	-2.50	2.40	7.13	18.04	25.32
	Earnings Per Share (after extraordinary items) (of Rs.10/- each)					
	Basic :	-2.50	2.40	7.13	18.04	25.32
	Diluted :	-2.50	2.40	7.13	18.04	25.32

Note:

- Above Audited Financial Results were reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on May 23, 2023
- The above is an extract of the detailed format of Standalone Audited Financial results for the quarter and year ended March 31, 2023 filed with Stock Exchange on 23rd May, 2023 under Reg 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Audited Financial Results are available on Stock Exchange website (www.bseindia.com) and the company website (www.corallab.com)
- The Company has adopted Ind AS for the financial year commencing from 1st April, 2017 and above results have been prepared in accordance with Ind AS, as prepared under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies Accounting Standards) Rule, 2015.

For and on behalf of the Board of Director of
Coral Laboratories Limited
Sd/-
Sushma Kadkade
Director & CFO
(DIN : 07791735)

Place : Mumbai
Date : 23rd May, 2023

Gujarat Pollution Control Board

Paryavaran Bhavan, Sector 10 A, Gandhinagar 382 010
Tel 079-23232152 Fax 079-23222784, www.gpcb.gujarat.gov.in

Public Notice

It is hereby to inform that as per Ministry of Environment, Forest & Climate Change, Government of India, New Delhi vide its Notification no. S.O. 1533 (E) dated September 14, 2006; Public Hearing has been fixed for **M/s North Gujarat Enviro Project for Common Hazardous Waste Treatment, Storage and Disposal Facilities (TSDFs) - Capacity 7,82,181 MT (04 Cells) & Incineration (solid & liquid waste)-1No. of 1 MT/hr, At Survey No. 2482, 2483, 2486, 2487, 2491, 2496, 2497, 2498, 2499, 2500, 2501, 2502, 2503, 2506, 2509, 2510, 2523, Village. Chanasma, Ta. Chanasma, District: Patan, Covered under project category "A" as mentioned in their request application.**

All local affected persons of the project are requested to remain present in the public hearing or send their response in writing to Member Secretary, Gujarat Pollution Control Board before the hearing date.

Other concerned persons having a plausible stake in environment aspects of the project or activity can submit their responses to Member Secretary, Gujarat Pollution Control Board in writing before the hearing date.

It may be noted that draft Environment Impact Assessment Report and Executive Summary of the Environment Impact Assessment Report of the project has been sent to the following authorities or offices to make it available for inspection to the public during normal office hours, till the Public Hearing is over.

- District Collector Office, **Patan.**
- District Development Office, **Patan.**
- District Industry Centre, **Patan.**
- Taluka Development Office, **Ta. Chanasma, Dist. Patan.**
- Regional Officer, Integrated Regional Office, Ministry of Environment, Forests and Climate Change, Room No. 407, Aranya Bhawan, Near CH-3 Circle, Sector - 10A, Gandhinagar, Gujarat - 382010
- Regional Office, Gujarat Pollution Control Board, Palanpur, Jilla Seva Sadana-2, Collector Office Complex, Joravar Palace, 3rd floor, Room No. 20 to 24, Palanpur.**

The District Magistrate /District Collector / Deputy Commissioner or his/her representative not below the rank of an Additional District Magistrate or any other District Level Officer authorized by him/her in this behalf shall supervise and preside over the entire public hearing process. (Note:- If a project or activity is confined to the territorial jurisdiction of one sub-division, the District Magistrate/District Collector/Deputy Commissioner may alternatively authorize any officer not below the rank of Sub-Divisional Magistrate to supervise and preside over the entire public hearing process).

The Public Hearing is scheduled to be held on **30/06/2023 at 10:00 Hrs, Venue: Project Site, Survey No. 2482, 2483, 2486, 2487, 2491, 2496, 2497, 2498, 2499, 2500, 2501, 2502, 2503, 2506, 2509, 2510, 2523, Village. Chanasma, Ta. Chanasma, District: Patan.**

Considering the present situation of pandemic of Covid-19 all concerned are hereby informed to follow Government guidelines regarding Covid-19 pandemic.

Place: Gandhinagar
Date: 05/05/2023

D. M. Thaker
Member Secretary

WESTERN RAILWAY-VADODARA DIVISION

OPEN 'E' TENDER NOTICE

OHE MODIFICATION

Tender No. EL/TRD/Tender/23-24/09 Tenders for and on behalf of The President of India are invited by Divisional Railway Manager (Electrical Tr.D) Western Railway, Pratapnagar, Vadodara-390004 for the following work: Sr. No. 1 **Tender No. & Name of Work: EL/TRD/Tender/23-24/09** Modification and alteration in existing OHE in connection with construction of Road Over Bridge between Kosad - Gothangam section of Vadodara division. **Approximate cost of the work (in ₹):** 88,35,716.60 **Earnest money to be deposited (in ₹):** 1,76,700/- **Cost of Tender document and completion period :** Free of cost. **Completion period 09 months. Tender scheduled on :** Tender closing date: 19.06.2023 and time of Closing at: 15.00 hrs. on the same date. **Web page particulars and notice for location where complete details can be seen & address of the office and clarification:** Website @ www.ireps.gov.in Divisional Railway Manager (Electrical Tr.D) Western Railway, Pratapnagar, Vadodara-390004. (EL/TRD/Tender/23-24/09 dtd. 18.05.2023)

Like us on: [facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

MINAXI TEXTILES LIMITED

CIN : L17119GJ1995PLC025007
Regd. Office : : Plot No.3311, GIDC, Phase IV, Chhatral, Taluka Kalol, Gandhinagar 382729

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.03.2023

Sr. No.	Particulars	For the Quarter ended 31/03/2023 (Audited)	For the Quarter ended 31/12/2022 (Unaudited)	For the Quarter ended 31/03/2022 (Audited)	Year ended 31/03/2023 (Audited)	Year ended 31/03/2022 (Audited)
		1	Total Income from Operations	683.69	603.34	1104.35
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-289.19	-160.26	-81.08	-830.36	-206.23
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	-289.19	-160.26	-81.08	-830.36	-206.23
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	-215.79	-120.11	-59.46	-621.28	-159.06
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-221.07	-119.98	-58.93	-626.17	-157.71
6	Equity Share Capital	494.16	494.16	494.16	494.16	494.16
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0	0	0	0	0
8	Earnings Per Share (of Rs. 1/- each (for continuing and discontinued operations) - 1. Basic: 2. Diluted:	-0.44	-0.24	-0.12	-1.26	-0.32

- NOTES :**
- The above Audited Financial Results for the Quarter and Year ended on 31st March 2023 have been reviewed by the Audit Committee, and have been considered and approved by the Board of Directors at its meeting held on 23rd MAY, 2023. The Financial Results for the year ended on 31st March, 2023 were audited by the Statutory Auditor. While placing this financial results before the Board, the Managing Director and the Chief Financial Officer Who has issued certificate as required under Regulation 33(2)(a) of the SEBI (LODR) Regulations, 2015.
 - The financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (IND AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other accounting principles generally accepted in India.
 - The Company vide its board meeting dated 10.02.23 has passed the resolution to write off the shares forfeited amount of Rs.61.87 lakhs which was long standing in the books of accounts. The corresponding 12384000 Equity shares forfeited were also written off during the year. There is no change in total paid up share capital of the company.
 - Figures for the previous periods have been regrouped wherever considered necessary.
 - The company is engaged in single segment of business i.e. Textiles and hence only one reportable operating segment as per Ind As 108 - Operating segments.
 - Figures for the quarter ended 31st March, 2022 and 31st March, 2021 represents the difference between the audited figures in respect to the full financial year and the published unaudited figures up to the end of the third quarter of the current financial year and previous financial year respectively, which were subjected to a limited review.
 - The Company has incurred cash losses in current year and preceding financial year. During the previous year the Company has executed debt restructuring scheme and restructured its overall borrowings. This will result into substantial reduction in the interest outflow for future period and has extended the repayment plan in relation to restructured borrowing. Further, the company expects to generate operational cash-inflows in near future, which will support the company to meet its near future cash obligations. Taking these factors into consideration, the Company believes financial information is fairly presented on going concern basis.
 - The Company is not a Large Corporate as per the applicability criteria given under the SEBI circular SEBI/HO/DDHS/CIR/P/2018/144 dated November 26, 2018.

For and on behalf of the Board
MINAXI TEXTILES LIMITED
Dineshkumar P Patel
(Managing Director)
DIN : 02268757

Place : Chhatral
Date : 23/05/2023